

ROTARY CLUB OF SURAT EAST

RI YEAR : 2020-2021

અંક : ૦૪ તા. : ૦૧/૧૧/૨૦૨૦

HOLGER KNAACK
RI. President

Rtn.PRASHANT JANI
District Governor

Rtn.JAGDISH VAGHASIA
Club President


Rtn.KETAN PATEL
Club Secretary

Rtn.AMULAKH SAVANI
Editor



Rtn. Dr. Jagdish Vagharia
Club President

e-bulletin
અપેક્ષા



નમસ્કાર રોટેરીયન મિત્રો,

સૌ રોટેરીયન મિત્રો સહુ પરિવાર કુશળ હશો, કોરોના કાળમાં ઘણા બધા તહેવારો એમ જ જતા રહ્યા અને આપણે કપલ કે ફેમીલી મીટીંગ કરી શક્યા નહતા પરંતુ દશરાનો તહેવાર આપણે ફેમીલી સાથે ઉજવ્યો, સાથે સાથે ગીત સંગીતની પણ મજા માણી, આપણે સૌ દિવાળીના તહેવારની રાહ જોઈ રહ્યા છીએ દિવાળી આપણે સૌ પરિવાર સાથે ઉજવીએ.

રોટરીમાં પણ આપણે સૌ સાથે મળીને નવા વર્ષમાં ઘણા લોકોપયોગી કાર્ય કરીએ, આપણી પાસે કોઈ સારો પ્રોજેક્ટ હોય, કોઈ સારો વિચાર હોય, તો આપ જણાવશો તો તેના પર વિચાર કરી આગળ વધીએ, રોટરીમાં સેવા સાથે આનંદ કરીએ રોટરી થકી બિઝનેસ પણ વધારીએ એ માટે આપણે RMB (Rotary Means Business) ગ્રુપ બનાવેલ છે જેમા આપ આપણા ધંધા વ્યવસાયની વિગત આપણા રોટેરીયન મિત્રો સાથે શેર કરી શકો છો.

નવેમ્બર માસમાં દિવાળી-પર્વ તથા બેસતું વર્ષ અને ભાઈબીજ જેવા પવિત્ર તહેવારો આવી રહ્યા છે આપ સૌ રોટેરીયન મિત્રોને દિવાળી પર્વ અને બેસતા વર્ષની ખૂબ-ખૂબ શુભકામઓ, નવું વર્ષે આપના તથા આપના પરિવાર માટે, સુખમય, આનંદમય તેમજ ફળદાયી નિવડે એવી હૃદયપૂર્વક શુભકામના.



શુભ દિવાવલો
સુતન વર્ષાભિનંદન
ભાઈબીજ





Rtn. Ketan Patel
Club Secretary

૦૯/૧૦/૨૦૨૦

World Animal Day ના દિવસે રોટરી સુરત ઈસ્ટ અને ઈનર વ્હીલ ક્લબ સુરત ઈસ્ટ ના સંયુક્ત ઉપક્રમે થારોલી પાંજરાપોળ ખાતે પશુ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરેલ આ સમગ્ર કેમ્પ નું આયોજન પશુ ચિકિત્સક ડૉ અતુલ પટેલ ની આગેવાની હેઠળ યોજાયો હતો.

જેમાં ડૉ. અતુલ પટેલ દ્વારા પાંજરાપોળ ના બીમાર પશુ ઓનું નિદાન અને સારવાર કરવામાં આવેલ જેમાં અંદાજે ૩૦૦૦૦ રૂ જેટલી રકમ ની દવા તેમજ જરૂરિયાત મંદ ૨૦૦ જેટલા પશુ ઓ ને રસીકરણ પણ કરવામાં આવેલ, કાર્યક્રમ ની વ્યવસ્થા IWC પ્રેસિડેન્ટ વીણાબેન પટેલ દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ પ્રમુખ રો ડૉ. જગદીશ વઘાસિયા, સેક્રેટરી રો કેતન પટેલ ઉપરાંત Past પ્રેસિડેન્ટ ડૉ અમૂલ્ય savani તેમજ રોટરેક્ટ સુરત ઈસ્ટ પ્રેસિડેન્ટ રોટરેક્ટર પ્રતીક વસોયા, રોટરેક્ટ કર્ણ ભુમિ પ્રેસિડેન્ટ રો ટ્રેક્ટર નિકુંજ હીરપરા અને તેઓ ની ટીમ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ નું સંચાલન રો ડૉ અતુલ પટેલ દ્વારા કરવામાં આવેલ અને સંકલન IWC વીણા બેન પટેલ દ્વારા કરવામાં આવેલ.

૦૯/૧૦/૨૦૨૦ થી ૧૧/૧૦/૨૦૨૦

ઓન લાઈન ધ્યાનોત્સવ માં રોટરી ક્લબ સુરત ઈસ્ટ ના સભ્યો એ ભાગ લીધેલ.

૧૦/૧૦/૨૦૨૦ અને ૧૧/૧૦/૨૦૨૦

રોટરી ક્લબ સુરત ઈસ્ટ અને રોટરી ક્લબ ઈમારી ડુડ હિલ્સ (એટલાન્ટા) ના સંયુક્ત ઉપક્રમે આજરોજ તા. 10/10/2020 શનિવારનાં રોજ દિવ્યાંગોને કૃત્રિમ હાથપગ અર્પણનાં કાર્યક્રમનું ઉદ્ઘાટન થયેલ છે, જેમાં અધ્યક્ષ સ્થાને મેયર શ્રી ડૉ.જગદીશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમનું સૌજન્ય રો. ચતુરભાઈ સભાયા કે જેઓ રોટરી ક્લબ ઈમોરી ડુડ હિલ્સ(એટલાન્ટા)ના પ્રમુખ દ્વારા પ્રાપ્ત થયેલ છે. આ કાર્યક્રમમાં નારાયણ સેવા સંસ્થાન ની ટીમ દ્વારા દિવ્યાંગોને અંગો ફીટ કરવામાં આવેલ. 117 જેટલા લાભાર્થીઓ ને 153 અંગો ફીટ કરવામાં આવેલ. કૃત્રિમ અંગો થી દિવ્યાંગ જનો ની જીવનમાં ઘણો સુધારો થઈ શકે છે અને તેઓ પોતાની દૈનિક ક્રિયા તેમજ કાર્ય ખુબ સારી રીતે કરી શકે છે. જેઓ હાથ અથવા પગ વગર જીવન વિતાવે છે એમના માટે આ કૃત્રિમ અંગો વરદાન સ્વરૂપ છે. કાર્યક્રમમાં ઉદ્ઘાટક રોટરી ડીસ્ટ્રીક્ટ 3060 ના ગવર્નર રો.પ્રશાંત જાની તેમજ મહેમાન તરીકે ચેમ્બર ઓફ કોમર્સનાં નવનિયુક્ત પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડિયા અને ખજાનચી મનીષ કાપડિયા ઉપરાંત શ્રી અગ્રણી ઉદ્યોગપતિ શ્રી હિંમતભાઈ ધોળકિયા, શ્રી મુકેશભાઈ ચોવડિયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું સંકલન રો.પ્રેસિડેન્ટ રો.ડૉ.જગદીશ વઘાસીયા, રો. કેતન પટેલ ,આઈ.પી.પી. રો. કિશોર બલર અને રો.રીનેશ ભીમાણી ના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટ ચરમેન રો.ચિંતન પટેલ અને રો.કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવેલ અને સહયોગી સંસ્થા રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ, રોટરેક્ટ ક્લબ ઓફ કર્ણભૂમિ સુરત ઈસ્ટ અને ઈનર વ્હીલ ક્લબ ઓફ સુરત ઈસ્ટ રહ્યા હતા. રોટરેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ ના પ્રમુખ રો. પ્રતિક વસોયા અને રોટરેક્ટ ક્લબ ઓફ કર્ણ ભૂમિ સુરત ઈસ્ટ ના પ્રમુખ રો.નીકુંજ હીરપરા તેમની ટીમે સમગ્ર કાર્યક્રમ ની જવાબદારી સંભાળેલ. ઈનર વ્હીલ ક્લબ ના પ્રમુખ શ્રીમતિ વીનાબેન પટેલ પણ અત્રે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ તા. 10 અને 11 શનિ અને રવિવાર બે દિવસ ચાલેલ.



૧૧/૧૦/૨૦૨૦

રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા નેત્ર નિદાન અને ફ્રી ચશ્મા વિતરણ નો કાર્યક્રમ, સૌરાષ્ટ્ર પટેલ સમાજ ની વાડી ખાતે યોજવામાં આવેલ, શનિવાર ના રોજ દિવ્યાંગો ને કૃત્રિમ અંગો ના વિતરણ ની સાથે આજરોજ રવિવારે નેત્ર નિદાન અને ફ્રી ચશ્મા વિતરણ નો પણ કાર્યક્રમ રાખેલ જેમાં લોક દૃષ્ટિ ચક્ષુ બેંક ના પ્રમુખ રો. ડૉ પ્રફુલ શીરોયા તેમજ રો. દિનેશભાઈ જોગણી દ્વારા નેત્ર નિદાન કરેલ અને આભાર ચશ્મા ઘર વાળા દિનેશભાઈ જોગણી તરફ જરૂરિયાત મંદ લોકો ને મફત ચશ્મા આપવામાં આવેલ. ક્લબ વતી દિનેશભાઈ નો ખુબ ખુબ આભાર આ કાર્યક્રમ માં અંદાજે 50 જેટલા લાભાર્થીઓ એ આ કેમ્પ નો લાભ લીધેલ .

૨૫/૧૦/૨૦૨૦

દશેરા ના પવન પર્વ પર ફેમીલી મીટીંગ નું આયોજન કરવામાં આવેલ ,જેમાં ૨૦૦ કરતા વધારે ની સંખ્યામાં સભ્યો પરિવાર સાથે હાજર રહ્યા . આ મીટીંગ માં રોટરી ડીસ્ટ્રીક્ટ ૩૦૬૦ દ્વારા યોજવામાં આવેલ INSPIRE પ્રોજેક્ટ માં ક્વોલીફાય થયેલ શિક્ષકો નું ડીસ્ટ્રીક્ટ લિટરસી ચેર રો. તુષાર શાહ ના હસ્તે સર્ટીફિકેટ આપીને સન્માન કરેલ, તેમજ ક્લબ માંથી પોલ હેરીસ ફેલો બનેલ રો. મિહિર ઠક્કર, રો.ડો. જગદીશ વઘાસીયા, રો. કિશોર બલર, રો. અરવિંદ શિરોયા, રો. ચેતના બેન શિરોયા અને રો. મહેશ સાવલિયા નું રો. તુષાર શાહ, રો.ઘનશ્યામ ખુંટ અને રો.રાજેશ વઘાસીયા ના હસ્તે પોલ હેરિશ પીન પહેરાવી સન્માન કરેલ. સાથે સાથે ગીત સંગીત નો પણ કાર્યક્રમ રાખેલ જેમાં આપણા ભૂતપૂર્વ રો.મુકેશ ભાલાણી એ મુકેશ ના અવાજ માં ગુજરાતી તથા હિન્દી ગીતો ગાઈ ને મજા કરવી હતી સાથે સાથે રો. ડો. અમુલખ સવાણી , હીના બેન મલકાન ,દક્ષા બેન પટેલ, ડો.હિંમત મિયાણીની અને ડો. સુરેશ ખેની એ પણ પોતાના આગવા અંદાજ માં ગીતો રજુ કરી ઉપસ્થિત રોટરી પરિવાર ના સભ્યો ને આનંદ કરાવેલ. આ કાર્યક્રમ માટે શર્મા નું સૌજન્ય રો.નટવર પાંચાણી તરફ થી મળેલ.

આગામી કાર્યક્રમો (નવેમ્બર)

તા.૦૪/૧૧/૨૦૨૦

રેગ્યુલર મિટીંગ

તા.૨૫/૧૧/૨૦૨૦

રેગ્યુલર મિટીંગ

જન્મદિન શુભેચ્છા ઓક્ટોબર-૨૦૨૦

04/11/2020	રો.ડો.ગોપાલ રાદડીયા
04/11/2020	રો.જીગ્નાશા ઠક્કર
09/11/2020	રો.આશિષ મોવલિયા
11/11/2020	રો.કેતન ધામી
23/11/2020	રો.જીતેન્દ્ર પટેલ
26/11/2020	રો.શૈલેષ શિહોરા
26/11/2020	રો.ઘનશ્યામ ખુંટ



“દુઆ છે અમારી કુલોની જેમ મહેકે જીંદગી તમારી...
જન્મદિવસની હાર્દિક શુભકામના..”



Rtn. Amulakh Savani
Bulletin Editor

Avenues of Service

We channel our commitment to service at home and abroad through five Avenues of Service, which are the foundation of club activity.

- Club Service focuses on making clubs strong. A thriving club is anchored by strong relationships and on active membership development plan.
- Vocational service calls on every Rotarian to work with integrity and contribute their expertise to the problems and needs of Society. Learn more in an introduction to vocational service and the code of conduct.
- Community Service encourages every Rotarian to find ways to improve the quality of life for people in their communities and to serve the public interest. Learn more in communities in Action: A Guide to effective Projects and this community Service Presentation(PPT).
- International Service exemplifies our global reach in promoting peace and understanding. We support this service avenue by sponsoring or volunteering on international projects, seeking partners abroad, and more.
- New Generations service recognizes the positive change implemented by youth and young adults through leadership development activities, involvement in community and international service projects, and exchange programs that enrich and foster world peace and cultural understanding.

Global Network

Solving real problems takes real commitment and vision. For more than 110 years, Rotary members have used their passion, energy and intelligence to take action on sustainable projects. From literacy and peace to water health, we are always working to better our world and we stay committed to the end.

Learn more about our structure. Our motto: service above self for more than 112 years, our guiding Principles have been the foundation of our values; services, fellowship, diversity, integrity and leadership. What we do Rotary members believe that we have a shared responsibility to take action on our world's most persistent issues. Our 35,000+ clubs work together to:

- Promote peace
- Fight disease
- Provide clean water, sanitation, and hygiene
- Save mothers and children
- Support Education
- Grow Local Economies



WE ARE PEOPLE OF ACTION

we connect passionate people with diverse perspective to exchange ideas, forge lifelong friendships and above all, take action to change the world.

WE ARE PROBLEM-SOLVES together, we apply our professional experience and personal commitment to tackle our communities most persistent problems, finding new effective ways to health, stability, and prosperity across the globe.

WE ARE OPPORTUNITY-CREATORS

Rotary members look for opportunities to improve our communities today and invest in the next generation for tomorrow.

WE ARE COMMUNITY-BUILDERS

We collaborate with community leaders who want to get to work on projects that have a real, lasting impact on people's lives.

WE WORK DIFFERENTLY


We see differently : Our Community disciplinary perspective helps us see challenges in unique ways.

We think differently : we apply leadership and expertise to social issues - and find unique solutions.

We act responsibly : Our passion and perseverance create lasting change.

We make a difference at home and around the world: Our Members can be found in your community and across globe.

Rotary
District 3060





Rtn. Amulakh Savani
Bulletin Editor

સૌની વ્યથાના હોય છે કારણ જુદા જુદા,
કારણ કે સૌના હોય છે રાવણ જુદા જુદા,
કોઈ હળવાશના સંગીત થી માણે જીંદગી,
દરેકના આ જગતમાં છે, તારણ જુદા જુદા.
(ડો. અમુલખ સવાણી)

:: વિજયા દશમી ની ઉજવણી ::

ચાલો સાથે મળી આપણે ઉભા કરેલા દુશ્મનો નો નાશ કરીએ, તો ચોક્કસ પોતાના માટે સારા કાર્યો કરવાનો પુરતો સમય મળશે.

આ દુશ્મનો કયા છે? આપણી આજુ બાજુ માંજ છે... જાણો છો???

૧. વધુ પડતુ ટીવી જોયા કરવુ. હાલના સંજોગોમાં ખાસ કરીને નવયુવાનો ને ટીવી માં આવતા અમુક ભડકાઉ પ્રોગ્રામ જોવાની આદત ભવિષ્ય માટે બહુજ મુશ્કેલી ઉભી કરે છે. Self discipline is the key to overcome this bad habit.
૨. Mobile excessive use of Phone and mobile આજના સમયમાં દરેક વ્યક્તિ mobile માં જ રચ્યા પચ્યા રહે છે. એટલે જો વિચારીને mobile નો ઉપયોગ કરવામાં આવે તો mobile આશિર્વાદ રૂપ છે.
૩. ગપ્પા મારવા. આ પણ હાની કારક આદત છે જેમાં સમયની બરબાદી શિવાય કંઈજ ફાયદો નથી. તો કુથલી કરવી એના કરતા સારુ વાંચન કરવુ જે જીવનમાં જોમ ભરે અને રચનાત્મક કામો થાય.
૪. વ્યસન કરવુ. કોઈ પણ પ્રકારનુ વ્યસન હાની કારક છે, સમય અને પૈસા બધુજ બગડે છે.
૫. આળસ કરવી. આળસ એ માણસનો મોટામાં મોટો દુશ્મન છે, ઘણા સારા કાર્યો આળસના કારણે અટકી પડે છે.
૬. રાત્રી ઉજાગરા. રાત્રે સમયસર સુઇ જવુ અને સવારે વહેલા તાજા માજા થઇ જાગી જવુ.
૭. સવારે મોડે સુધી સુતુ રહેવુ. સવારે મોડા જાગવાથી સમય સુચકતા નુ ભાન રહેતુ નથી.
૮. જાગીને તુરત મોબાઇલ અને ટીવી જોવુ. જીંદગીનો જંગ જીતવા સવારે વહેલા જાગીને પોતાની તાસીરને અનુકુળ હળવી કસરત તથા ચાલવાની ટેવ પાડવી. જીવનમાં એક નિયમ બનાવવો કે જાગીને પ્રભુ નો આભાર માનીએ અને નિત્ય નિયમોનુ પાલન કરવુ. તુરતજ mobile જોવાની કુટેવ હોય તો સુધારી લેવી.
૯. વિડીયો ગેમ મા સમય બગાડવો. દરેક electronic ઉપકરણો ના વધુ પડતા ઉપયોગ થી એકલતા નો અનુભવ થાય છે અને depression પણ આવે છે.
૧૦. કારણ વગર ઉગ્ર થવુ. કોઈ પણ સંજોગોમાં શાંત ચિત્તે નિર્ણયો લેવા ઉતાવળા થવાથી કે ઉગ્ર થવાથી વર્તમાન બગડે છે પછી પછતાવા થી કોઈ ફાયદો નથી. યુવાધન નો પંથ ડામાડોળ દિસે છે.
(આ દસ દુશ્મનો નો નાશ કરશુ તો રાવણ દહન ની જરુર નહીં પડે અને સાચુ જીવન જીવવા નો ખરો રસ્તો મળી જશે.)

(રત્ન કણિકા)

“સંબંધોના કેનવાસ પર પીંછીનો પહેલો નહી પણ છેલ્લો લસરકો નક્કી કરતો હોય છે કે આપણે અત્યાર સુધી દોરેલુ ચિત્ર કેવું બન્યું છે..”

ROTARY CLUB OF SURAT EAST

:: PHOTO GALLERY ::



